

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૬/૦૮/૨૦૧૭ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી અને જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૮૪૫/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૩ કેસ કરી, ૧૯ વ્યક્તિઓને ઝડપી, ૩૬૯ લીટર દેશી દારૂ, ૦૧ સ્કુટર અને ૦૧ ઓટોરીક્ષા કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૩ કેસ કરી, ૦૭ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૭,૪૯૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યાં હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૪૬/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૬૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૮૪૭/૧૭

માધવપુરા : અંબાલાલ સવજી ચૌધરી (ઉ.વ.૩૭)(રહે.પ્રીસ લેમીટેડ ગ્રાઉંડ ફ્લોર એ/૨ મેસન, નવસીર-ભરૂચ રોડ મુંબઈ-૦૭ મહારાષ્ટ્ર) એ તા.૨૫/૮/૧૭ નારોજ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૬/૧૭ થી તા.૧૫/૦૭/૧૭ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧)(દલાલ) મનોજભાઈ પંડ્યા (૨) મહેન્દ્રભાઈ જાડેજા (૩) પ્રકાશભાઈ વાળંદ (૪) અનીલભાઈ ઠક્કર (૫) લતાબેન અનિલભાઈ ઠક્કર (રહે.સુર્યારથ એપાર્ટમેંટ ગ્રાઉંડ ફ્લોર બરોડા એક્ષપ્રેસ હાઇ-વે ની પાસે કચ્છ કડવા પાટીદાર સમાજવાડી પાસે ન્યુ મણીનગર) (૬) ઉમેશ ઠક્કર (૭) નેહા ઉર્ફે પીમી મહેશભાઈ દંતાણી (૮) જયશ્રીબહેન ઉર્ફે ગીતાબેન મહેશભાઈ દંતાણી (રહે.દેવીપુજક વાસ, જે.જે.ચવાણાની પાછળ, પ્રેમ દરવાજા) ભેગામળી અંબાલાલનાં લગ્ન નેહા ઉર્ફે પીમી નાઓ સાથે કરાવવાની લાલચ આપી, અંબાલાલ પાસેથી રોકડ રૂપિયા ૩,૫૦,૦૦૦/- મેળવી લઈ, અંબાલાલ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી પ્રવિણસિંહ કાનાજી ચલાવે છે.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૧૯૪૮/૧૭

ઓઢવ : રાકેશભાઈ મણીલાલ પટેલ (રહે, દેવકૃપા રેસીડેન્સી, પામ હોટલથી મનમોહન જવાન રોડ ઉપર નિકોલ) એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨૪/૦૯/૧૭ સાંજનાં ૬/૦૦ થી તા.૨૫/૯/૧૭ ના કલાક ૯/૦૦ વાગ્યા દરમ્યાન ઓઢવ, વેપારી મહામંડળ સામે શેડ નંબર એ/૧૨૫ બિલેશ્વર એસ્ટેટ નામની પોતાની કંપનીમાં કોઈ અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, કંપનીમાંથી કોપર વાયરના ૨૦ કિલો ના ૭ બંડલ કિંમત રૂપીયા ૮૭,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.એન.ખાંટ ચલાવે છે.

સોનાનો દોરો ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૧૯૪૯/૧૭

મણીનગર : અજયભાઈ ચંપકલાલ મોદી ઉંવ.૫૮ રહે- બી/૨, બ્લોક નં.૧૦૫, સામ્રાજ્ય ટાવર, માનવમંદિર પાછળ, મેમનગર) એ તા.૨૫/૯/૧૭ નારોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨૪/૦૯/૧૭ રાતનાં ૧૦/૦૦ વાગ્યાનાં સુમારે ભૈરવનાથ રોડ રામગલી પ્રાથમિક સ્કૂલની સામે રોડ ઉપરથી પોતાની પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૦ થી ૨૫ વર્ષના આશરનાં) અજયભાઈની પત્નીનાં ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપીયા ૨૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એન.પરમાર ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૯૫૦/૧૭

ગાયકવાડ હવેલી : સાયમાબાનુ ડો/ઓફ ઇમરાનભાઈ અજમેરવાલા (ઉ.વ.૨૦)(રહે,મહાજનનો વંડા પાસે ખાટકીવાડ જમાલપુર) એ કોઈ અગમ્ય કારણોસર તા.૨૫/૦૯/૧૭ ના કલાક ૭/૦૦ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે દવા પી જતાં, સારવાર માટે તેમને વા.સા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તા.૨૫/૦૯/૨૦૧૭ ના કલાક ૭/૪૫ વાગે ફરજ પરનાં ડો.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ પો.સ.ઇ. વી.યુ.પાડવી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.